


RAN-2401001202030007
B.A. (NEP) (Sem. - II) Examination November - 2025
Minor - II Economics - II (Theory of Value)(Paper - II)
Time: 2 Hours]
[Total Marks: 50
સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) જમણી બાજુ પ્રશ્નોના ગુણ દર્શાવવામાં આવ્યા છે.
The question marks are shown on the right.
- (3) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
All question are mandatory.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર. 1 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (કોઈ પણ પાંચ) (10)**
1. પૂર્ણ હરીફાઈનો અર્થ જણાવો.
 2. પેઢીની લાંબાગાળાની સમતુલાની શરતો જણાવો.
 3. વેચાણ ખર્ચનો અર્થ જણાવો.
 4. કાર્ટેલ એટલે શું?
 5. કિંમત નેતૃત્વ એટલે શું?
 6. સાધનની સીમાંત ઉત્પાદકતાનો અર્થ જણાવો.
 7. વાસ્તવિક વેતન એટલે શું?
- પ્ર. 2 ઈજારાવાળા બજારમાં ટૂંકાગાળામાં અને લાંબાગાળામાં પેઢીની સમતુલા આકૃતિની મદદથી સમજાવો. (14)**
- અથવા**
- પ્ર. 2 (અ) અલ્પહસ્તક ઈજારના લક્ષણો સમજાવો. (07)**
- (બ) વેચાણ ખર્ચની માંગરેખા પરની અસરો જણાવો. (07)**
- પ્ર. 3 વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો. (14)**
- અથવા**
- પ્ર. 3 રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત સવિસ્તારથી સમજાવો. (14)**
- પ્ર. 4 ટૂંક નોંધો લખો. (કોઈ પણ બે) (12)**
1. કિંમત ભેદભાવના પ્રકાર
 2. ખાંચવાળી માંગરેખા
 3. વહેંચણીનો આધુનિક સિદ્ધાંત
 4. આભાસી ભાડાનો ખ્યાલ

ENGLISH VERSION

- Q. 1 Answer the following Questions briefly. (Any Five) (10)**
1. Explain the meaning of perfect competition.
 2. State the conditions of long-run equilibrium of a firm.
 3. State the meaning of selling costs.

4. What is a cartel?
5. What is price leadership?
6. What is the meaning of marginal productivity of a factor?
7. What is real wage?

Q. 2 Explain with the help of a diagram the equilibrium of a firm in the short run and the long run in a monopoly market **(14)**

OR

Q. 2 (A) Explain the characteristics of oligopoly. **(07)**

(B) State the effects of selling costs on the demand curve. **(07)**

Q. 3 Explain the marginal productivity theory of distribution.. **(14)**

OR

Q. 3 Explain in detail Ricardo's theory of rent. **(14)**

Q. 4 **Write the short note. (Any two)** **(12)**

1. Types of Price Discrimination
2. Kinked Demand Curve
3. Modern Theory of distribution
4. Concept of quasi-Rent.
